

સરદાર સ્મૃતિ કેન્દ્ર
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
જૂનાગઢ

ફોન નંબર - ૨૬૭૨૦૮૦, પીબીએક્સ નં. ૩૩૨

તાલીમાર્થીઓ	:	અમરેલી જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ
તાલીમનો સમયગાળો	:	તા. ૨૩-૨૫, નવેમ્બર-૨૦૧૧
તાલીમાર્થીઓની અંદાજીતસંખ્યા	:	૩૫ (પાંત્રીસ)
તાલીમનું સ્થળ	:	સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂ. કૃ. યુ., જૂનાગઢ

✂ તાલીમ સંકલનકાર ✂


પ્રો. જી. જી. મારકણા
સહ પ્રાધ્યાપક

પ્રો. બી. એન. કલસરીયા
મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી

--:: તાલીમ કાર્યક્રમ ::--

તારીખ / સમય તા. : ૨૩.૧૧.૧૧	વિષય	વક્તા
૦૮.૦૦ થી ૦૮.૩૦ ૦૮.૦૦ થી ૧૦.૦૦	આગમન અને નોંધણી તાલીમ વર્ગનું ઉદ્ઘાટન	પ્રો. બી. એન. કલસરીયા ડો. એ. એમ. પારખીયા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી
૧૦.૦૦ થી ૧૦.૩૦	સરદાર સ્મૃતિ કેન્દ્રના મ્યુઝીયમની મુલાકાત અને ચર્ચા	પ્રો. બી. એન. કલસરીયા પ્રો. જી. જી. મારકણા
૧૦.૩૦ થી ૧૧.૩૦	શિયાળુ તેલીબિયાં પાકોની વૈજ્ઞાનિક ખેતી અને તેના પ્રશ્નો - ચર્ચા (સ્થળ : તેલીબિયાં મ્યુઝીયમ)	ડો. કે. વી. જાદવ તેલીબિયાં વિભાગ
૧૧.૩૦ થી ૧૨.૩૦	કિટકશાસ્ત્ર, રોગશાસ્ત્ર, કૃષિ ઈજનેરી વિભાગની મુલાકાત	પ્રો. બી. એન. કલસરીયા
૧૨.૩૦ થી ૧૫.૦૦	ભોજન વિરામ	શ્રી એચ. એમ. કુંજડીયા
૧૫.૦૦ થી ૧૬.૦૦	અગત્યના ખેતી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા-ચર્ચા	પ્રાધ્યાપકશ્રી, કિટકશાસ્ત્ર વિભાગ
૧૬.૦૦ થી ૧૬.૧૫ ૧૬.૧૫ થી ૧૭.૧૫	ચા - વિરામ અગત્યના ખેતી પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ વ્યવસ્થા-ચર્ચા	પ્રાધ્યાપકશ્રી, રોગશાસ્ત્ર વિભાગ
૧૭.૧૫ થી ૧૮.૧૫	પાક ઉત્પાદનમાં સેન્દ્રીય ખાતરોનું મહત્વ અને સજીવ ખેતી	ડો. આર. કે. માથુકીયા કૃષિ વિજ્ઞાન વિભાગ
તા. ૨૪.૧૧.૨૦૧૧		
૦૮.૩૦ થી ૦૮.૩૦	પશુ ઉછેર કેન્દ્રની મુલાકાત અને પશુ પોષણ, માવજત અને દૂધ ઉત્પાદન વધારવા માટેના ઉપાયો અને ચર્ચા (સ્થળ : સી બી એફ)	ડો. બી. એલ. પરમાર પ.નિ.તા.કે. અને શ્રી એચ. એમ. કુંજડીયા
૦૮.૩૦ થી ૧૦.૦૦ ૧૦.૦૦ થી ૧૦.૩૦ ૧૦.૩૦ થી ૧૧.૦૦	કપાસ ફાર્મની મુલાકાત અને ચર્ચા તેલીબિયાં ફાર્મની મુલાકાત અને ચર્ચા વર્મી કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ અને ખેતીમાં તેનું મહત્વ (સ્થળ : કૃષિગઢ)	સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કપાસ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, તેલીબિયાં પ્રાધ્યાપકશ્રી, એગ્રોનોમી વિભાગ

૧૧.૦૦ થી ૧૧.૩૦	શાકભાજી ફાર્મની મુલાકાત અને પ્રશ્નો-ચર્ચા	સંશોધન વૈજ્ઞાનિકશ્રી (લ. ડું) શાકભાજી વિભાગ
૧૧.૩૦ થી ૧૨.૦૦	ફાર્મ મશીનરી અને પાવર વિભાગ મુલાકાત અને ચર્ચા	ફાર્મ મશીનરી અને પાવર વિભાગ
૧૨.૦૦ થી ૧૨.૩૦ ૧૨.૩૦ થી ૧૫.૦૦	પ્રોસેસીંગ વિભાગની મુલાકાત અને ચર્ચા ભોજન વિરામ	પ્રોસેસીંગ વિભાગ
૧૫.૦૦ થી ૧૬.૦૦	અગત્યના બાગાયતી પાકોની ખેતીના ચાવીરૂપ મુદ્દા અને નેટ હાઉસમાં ઉગાડી શકાતા પાકોની માહિતી	પ્રાધ્યાપકશ્રી, બાગાયત વિભાગ, જૂનાગઢ
૧૬.૦૦ થી ૧૬.૧૫ ૧૬.૧૫ થી ૧૭.૧૫	ચા - વિરામ ખેતી પાકોમાં સંકલિત નીંદણ નિયંત્રણ વ્યવસ્થા	ડો. બી.કે.સગારકા એગ્રોનોમી વિભાગ, જૂનાગઢ
૧૭.૧૫ થી ૧૮.૦૦	મુખ્ય અને ગૌણ પોષક તત્વોની ખામીથી ખેતી પાકો ઉપર અસર, તેના નિરાકરણના ઉપાયો અને પાણી દ્વચ ખાતરોની માહિતી	પ્રાધ્યાપકશ્રી, કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ
તા. ૨૫.૧૧.૨૦૧૧		
૦૮.૩૦ થી ૦૯.૩૦	ઓષધિય વનસ્પતિની ઓળખ અને તેનું માનવ જીવનમાં મહત્વ. (સ્થળ : મોતીબાગ)	પ્રાધ્યાપકશ્રી, બોટાની વિભાગ
૦૯.૩૦ થી ૧૦.૩૦	આંબા, ચીકુ, બોર, જામફળ, અને ગુલાબનાં વર્ધનની રીતો અને કલમ કરવાનું નિદર્શન (સ્થળ- લાલબાગ)	ડો. આર. એસ. ચોવટીયા બાગાયત વિભાગ, જૂનાગઢ
૧૦.૩૦ થી ૧૧.૩૦	નેટ / ગ્રીન હાઉસમાં ઉગાડી શકાતા બાગાયતી, શાકભાજી, ફૂલ પાકોની ખેતી , ચર્ચા અને મુલાકાત (સ્થળ: બાગાયત વિભાગ)	ડો. કે.ડી.પટેલ બાગાયત વિભાગ
૧૧.૩૦ થી ૧૨.૩૦	કૃષિ / બાગાયતી પાકોમાં સૂક્ષ્મ પિયત / ટપક પિયત પદ્ધતિની ઉપયોગીતા, મલ્ટીંગનો ફાળો અને અર્થક્ષમ ઉત્પાદન મેળવવા માટેની ચાવીઓ	ડો. એચ. ડી.રાંક જળ અને જમીન વિભાગ
૧૨.૩૦ થી ૧૫.૦૦	ખેડૂતોના પ્રતિભાવો અને સમાપન	


 (એ. એમ. પારખીયા)
 વિસ્તરણ શિક્ષણ નિયામક
 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
 જૂનાગઢ

જાન/જૂકૃયુ/સસકે/તાલીમ/ ૨૦૨૪-૨૦૫૫/૧૧ જૂનાગઢ તારીખ : ૨૫ . ૧૧ . ૨૦૧૧

નકલ સવિનય રવાના :

- (૧) સંશોધન નિયામકશ્રી, જૂ.કૃ.યુ., જૂનાગઢ તરફ જાણ સારું.
- (૨) આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ તરફ જાણ સારું.
- (૩) આચાર્યશ્રી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ તરફ જાણ સારું.
- (૪) માનનીય કુલપતિનાં રહસ્ય સચિવશ્રી, જૂ.કૃ.યુ., જૂનાગઢ તરફ જાણ સારું.
- (૫) વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીની ટેક - ૩ શાખા તરફ જાણ સારું.
- (૬) સંબંધિત વકતાશ્રીઓને જાણ તથા વ્યાખ્યાન સમયે હાજર રહેવા તેમજ એલ.સી.ડી.નો ઉપયોગ કરવાનો હોય તો અગાઉથી જાણ કરવા વિનંતી સહ.

(૭) બિ.યા.ટ.કૃ.શ્રી, આઈ.ટી.સેલ, જૂ.કૃ.યુ., જૂનાગઢ વેબસાઇટ પર વ્યુઝ સ્વરૂપે મૂકવા સારું.

નકલ જયભારત સાથ રવાના :

પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, અમરેલી તરફ જાણ તથા તાલીમાર્થીઓ સમયસર તાલીમ કેન્દ્ર પર પહોંચે તે માટે ઘટતું કરવા સારું